

This is a public announcement for information purposes only and is not a prospectus announcement and does not constitute an invitation or offer to acquire, purchase or subscribe to securities. Not for release, publication or distribution directly or indirectly, outside India. Initial public offer of equity shares on the main board of the Stock Exchanges in compliance with Chapter II of the Securities and Exchange Board of India (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, as amended ("SEBI ICDR Regulations").



SANATHAN TEXTILES LIMITED



(Please scan this QR Code to view this Corrigendum)

Our Company was incorporated as 'Sanathan Textiles Private Limited', at Kolkata, West Bengal as a private limited company under the Companies Act, 1956 and received a certificate of incorporation issued by the RoC, on October 10, 2005. Thereafter, our Company was converted into a public limited company pursuant to a resolution passed by the shareholders of our Company passed in their meeting on November 12, 2021, and the name of our Company was changed to its present name 'Sanathan Textiles Limited', pursuant to a fresh certificate of incorporation issued by the RoC on November 18, 2021. For details of changes in the name and registered office of our Company, see 'History and Certain Corporate Matters' on page 271 of the red herring prospectus of the Company dated December 13, 2024 (RHP) filed with the RoC.

Corporate Identification Number: U17299DN2005PLC005690; Registered Office: SRV No. 187/4/1/2, Near Surangi Bridge, Surangi, Dadra & Nagar Haveli, Silvassa - 396230, India

Corporate Office: D-15, Trade World Building Kamala Mills Compound, Senapati Bapat Marg Lower Parel, Mumbai - 400013, Maharashtra, India; Contact Person: Dsouza Jude Patrick, Company Secretary and Compliance Officer;

Tel: + 91 22 6634 3312/3/4/5/6; E-mail: investors@sanathan.com; Website: https://www.sanathan.com

OUR PROMOTERS: PARESH VRAJLAL DATTANI, AJAY VALLABHDAS DATTANI, ANILKUMAR VRAJIDAS DATTANI, DINESH VRAJIDAS DATTANI, NIMBUS TRUST, D&G FAMILY TRUST, A&J FAMILY TRUST AND P&B FAMILY TRUST

INITIAL PUBLIC OFFER OF UP TO [•] EQUITY SHARES OF FACE VALUE OF ₹10 EACH (EQUITY SHARES) OF SANATHAN TEXTILES LIMITED ('COMPANY' OR 'ISSUER') FOR CASH AT A PRICE OF [•] PER EQUITY SHARE (INCLUDING A SHARE PREMIUM OF ₹ [•] PER EQUITY SHARE) (OFFER PRICE) AGGREGATING UP TO ₹5,500.00 MILLION (OFFER) COMPRISING A FRESH ISSUE OF UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹ 4,000.00 MILLION BY OUR COMPANY (FRESH ISSUE) AND AN OFFER FOR SALE OF UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹1,500.00 MILLION BY THE SELLING SHAREHOLDERS (OFFER FOR SALE) COMPRISING UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹309.37 MILLION BY PARESH VRAJLAL DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹346.75 MILLION BY AJAY VALLABHDAS DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹355.62 MILLION BY ANILKUMAR VRAJIDAS DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹371.88 MILLION BY DINESH VRAJIDAS DATTANI (THE 'PROMOTER SELLING SHAREHOLDERS'), UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹2.50 MILLION BY VAJUBHAI INVESTMENTS PRIVATE LIMITED, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹2.50 MILLION BY VALLABHDAS DATTANI HUF, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹22.50 MILLION BY SONALI AJAYKUMAR DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹2.50 MILLION BY DATTANI DINESHKUMAR VRAJIDAS HUF AND UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹35.00 MILLION BY BEENA PARESH DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹17.50 MILLION BY ANILKUMAR VRAJIDAS DATTANI HUF, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹30.00 MILLION BY PARESH KUMAR V DATTANI HUF, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹1.25 MILLION BY JAYSHREE ANILKUMAR DATTANI, UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹2.50 MILLION BY VALLABHDAS DATTANI AND UP TO [•] EQUITY SHARES AGGREGATING UP TO ₹0.13 MILLION BY AJAY KUMAR V DATTANI HUF (THE 'PROMOTER GROUP SELLING SHAREHOLDERS' AND TOGETHER WITH THE PROMOTER SELLING SHAREHOLDERS, COLLECTIVELY REFERRED AS 'SELLING SHAREHOLDERS' AND SUCH OFFER FOR SALE BY THE SELLING SHAREHOLDERS, THE 'OFFER FOR SALE').

| DETAILS OF THE OFFER FOR SALE BY THE SELLING SHAREHOLDERS | | | |
|---|------------------------------------|---|--|
| NAME OF THE SELLING SHAREHOLDER | TYPE | AMOUNT (IN ₹ MILLION) | WEIGHTED AVERAGE COST OF ACQUISITION PER EQUITY SHARES* (IN ₹) |
| Paresh Vrajlal Dattani | Promoter Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹309.37 million | 3.51 |
| Ajay Vallabhdas Dattani | Promoter Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹346.75 million | 3.40 |
| Anilkumar Vrajidas Dattani | Promoter Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹355.62 million | Nil |
| Dinesh Vrajidas Dattani | Promoter Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹371.88 million | Nil |
| Vajubhai Investments Private Limited | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Vallabhdas Dattani HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Sonali Ajaykumar Dattani | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹22.50 million | 30.36 |
| Dattani Dineshkumar Vrajidas HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Beena Paresh Dattani | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹35.00 million | Nil |
| Anilkumar Vrajidas Dattani HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹17.50 million | Nil |

*Calculated on a fully diluted basis. As certified by the independent Chartered Accountant, Jain Tripathi & Co, pursuant to a certificate dated December 17, 2024. For a complete list of all Selling Shareholders and their average cost of acquisition per Equity Share, see 'Summary of the Offer Document - Average Cost of Acquisition of our Promoters and the Selling Shareholders' on page 31 of the RHP.

NOTICE TO INVESTORS

Potential Bidders may note the following:

i. Some of our Promoters and members of our Promoter Group have sold Equity Shares at a price of ₹321 per Equity Share, after the date of the RHP, as set out below (Transfers):

| Sr. No | Date of Transfer | Name of the Transferor | Nature of Relationship with Company | Name of Transferee | Nature of Relationship with Company | Nature of Transfer | Number of Equity Shares | Percentage of total pre-Offer paid up Equity Share capital (%) | Transfer price per Equity Share (in ₹) | Total consideration (in ₹ million) |
|--------|-------------------|--------------------------------|-------------------------------------|--|-------------------------------------|-----------------------|-------------------------|--|--|------------------------------------|
| 1. | December 17, 2024 | Dinesh Vrajidas Dattani | Promoter | Arjun Nishit Dhruva | - | Sale of Equity Shares | 31,000 | 0.04 | 321.00 | 9.95 |
| 2. | | | | Siddharth Patel | - | | 24,800 | 0.03 | 321.00 | 7.96 |
| 3. | | | | Hiranya Jaysinh Ashar | - | | 20,200 | 0.03 | 321.00 | 6.48 |
| 4. | | | | Komal Vishal Kothari | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 5. | | | | MBE Enterprise LLP | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 6. | | | | Vinay Pradeep Gandhi* | - | | 9,340 | 0.01 | 321.00 | 3.00 |
| 7. | | | | Ashiesh Siddharth Shah | - | | 7,800 | 0.01 | 321.00 | 2.50 |
| 8. | | | | Rutvik Anil Mehta | - | | 7,800 | 0.01 | 321.00 | 2.50 |
| 9. | | | | Pratik Mukesh Panchmatia | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 10. | | | | Yash Patwari | - | | 6,600 | 0.01 | 321.00 | 2.12 |
| 11. | | | | Taurus Petroleums Private Limited | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 12. | | | | Mitali Siddharth Patel | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 13. | | | | Krish Vishu Ramnani | - | | 6,000 | 0.01 | 321.00 | 1.93 |
| 14. | | | | Dhara Ripal Doshi | - | | 5,350 | 0.01 | 321.00 | 1.72 |
| 15. | | | | Mayuri Konal Doshi | - | | 5,350 | 0.01 | 321.00 | 1.72 |
| 16. | | | | Archana Doshi | - | | 5,300 | 0.01 | 321.00 | 1.70 |
| 17. | | | | Divyen Ketan Doshi | - | | 5,000 | 0.01 | 321.00 | 1.61 |
| 18. | | | | Adit Ripple Doshi | - | | 5,000 | 0.01 | 321.00 | 1.61 |
| 19. | | | | Jugal Konal Doshi | - | | 5,000 | 0.01 | 321.00 | 1.61 |
| 20. | | | | Shobha Yashwant Mehta | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 21. | | | | Yashwant Mansukhtal Mehta | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 22. | | | | Ami Ketan Shah | - | | 4,500 | 0.01 | 321.00 | 1.44 |
| 23. | | | | Deepen P Shah | - | | 4,500 | 0.01 | 321.00 | 1.44 |
| 24. | | | | Pradeep Gulabrai Gandhi* | - | | 3,115 | Negligible | 321.00 | 1.00 |
| 25. | | | | Heeral Pradeep Gandhi* | - | | 3,115 | Negligible | 321.00 | 1.00 |
| 26. | | | | Pradeep Gulabrai Gandhi HUF* | - | | 3,115 | Negligible | 321.00 | 1.00 |
| 27. | | | | Chhaya Pradeep Gandhi* | - | | 3,115 | Negligible | 321.00 | 1.00 |
| 28. | | | | Charmi M Thakkar* | - | | 3,100 | Negligible | 321.00 | 1.00 |
| 29. | | | | Karan Vir Jolly* | - | | 2,800 | Negligible | 321.00 | 0.90 |
| 30. | | | | H N Mehta HUF | - | | 2,500 | Negligible | 321.00 | 0.80 |
| 31. | | | | Punyashali Sanjay Parekh | - | | 2,500 | Negligible | 321.00 | 0.80 |
| 32. | | | | Lata Jha | - | | 1,600 | Negligible | 321.00 | 0.51 |
| 33. | | | | Supriya Anand Vakharia | - | | 1,500 | Negligible | 321.00 | 0.48 |
| 34. | | | | Silviya Gonsalves* | - | | 800 | Negligible | 321.00 | 0.26 |
| 35. | December 17, 2024 | Anilkumar Vrajidas Dattani | Promoter Group | Raj Kumar Jain | - | Sale of Equity Shares | 31,000 | 0.04 | 321.00 | 9.95 |
| 36. | | | | Rita Rajendra Shah | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 37. | | | | Mudit Subhashchandra Agarwal | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 38. | | | | Vedansh Surendra Jiwarajka | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 39. | | | | Jayshree Kaushikbhai Mody* | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 40. | | | | Hiranya Jaysinh Ashar | - | | 12,400 | 0.02 | 321.00 | 3.98 |
| 41. | | | | Lalit Chandrakant Shah | - | | 10,900 | 0.02 | 321.00 | 3.50 |
| 42. | | | | Birma Suresh Makhija | - | | 10,900 | 0.02 | 321.00 | 3.50 |
| 43. | | | | Ankit Prakash Mashru | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 44. | | | | Nishit J Pathak | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 45. | | | | Vedant Dattani* | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 46. | | | | Sundeep J Shah | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 47. | | | | Ranbir Kumar Vij | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 48. | | | | Shanti Bahety | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 49. | | | | Vidita Kochhar | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 50. | | | | Ramya Mandiramoorthy* | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 51. | | | | Rishab Chandak | - | | 3,100 | Negligible | 321.00 | 1.00 |
| 52. | | | | Lakshmi Srinivasan* | - | | 1,500 | Negligible | 321.00 | 0.48 |
| 53. | | | | Sudha Mohan | - | | 1,500 | Negligible | 321.00 | 0.48 |
| 54. | December 17, 2024 | Anilkumar Vrajidas Dattani HUF | Promoter Group | Yuvraj Ashok Thakker | - | Sale of Equity Shares | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 55. | | | | Atul R Mashru HUF* | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 56. | | | | Zahid Mohamed Amin Esmail | - | | 9,300 | 0.01 | 321.00 | 2.99 |
| 57. | | | | Amrit Jain | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 58. | | | | Hari Shankar Panchloria | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 59. | | | | Seksania Confectionaries Private Limited | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 60. | | | | Aar Em Ventures LLP | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 61. | December 17, 2024 | Jayshree Anilkumar Dattani | Promoter Group | Gandhia Maheshkumr Bhagvandas | - | Sale of Equity Shares | 4,600 | 0.01 | 321.00 | 1.48 |

| Sr. No. | Date of Transfer | Name of the Transferor | Nature of Relationship with Company | Name of Transferee | Nature of Relationship with Company | Nature of Transfer | Number of Equity Shares | Percentage of total pre-Offer paid up Equity Share capital (%) | Transfer price per Equity Share (in ₹) | Total consideration (in ₹ million) |
|---------|-------------------|------------------------|-------------------------------------|-----------------------------------|-------------------------------------|-----------------------|-------------------------|--|--|------------------------------------|
| 62. | December 17, 2024 | Vallabhdas Dattani | Promoter Group | Hiranya Jaysinh Ashar | - | Sale of Equity Shares | 67,000 | 0.09 | 321.00 | 21.51 |
| 63. | | | | Aayush Mittal | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 64. | | | | Shivangi V Paranjape | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 65. | | | | Harsh Naval Saraf | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 66. | | | | JaiKarni Holdings Private Limited | - | | 15,500 | 0.02 | 321.00 | 4.98 |
| 67. | | | | Hitesh Dani | - | | 12,400 | 0.02 | 321.00 | 3.98 |
| 68. | | | | Toral Kamdar | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 69. | | | | Yuvraj Dani | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 70. | | | | Manish Chhabildas Kamdar | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 71. | | | | Rakesh Mahnot | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 72. | | | | Mayank Ramniklal Mashru | - | | 7,700 | 0.01 | 321.00 | 2.47 |
| 73. | | | | Arni Gokani* | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 74. | | | | Kareena Kanani* | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 75. | | | | Suketu Bipinchandra Dattari | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 76. | | | | Parikshit Engineer HUF* | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 77. | | | | Rahul Rajat Doshi | - | | 6,200 | 0.01 | 321.00 | 1.99 |
| 78. | | | | Shradha Shashikant | - | | 5,600 | 0.01 | 321.00 | 1.80 |
| 79. | | | | Jitesh Bavishi | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 80. | | | | Amrit Sonpal | - | | 4,600 | 0.01 | 321.00 | 1.48 |
| 81. | | | | Mitesh Chhabildas Kamdar | - | | 3,800 | 0.01 | 321.00 | 1.22 |
| 82. | | | | Mona M Kamdar | - | | 3,800 | 0.01 | 321.00 | 1.22 |
| 83. | | | | Sanjay M Badiyani | - | | 3,400 | Negligible | 321.00 | 1.09 |
| 84. | | | | Shailesh Dudhwewala HUF | - | | 3,400 | Negligible | 321.00 | 1.09 |
| 85. | | | | Pushpa Kamdar | - | | 3,100 | Negligible | 321.00 | 1.00 |
| 86. | | | | Hariprasad Gounishankar Chandak | - | | 3,100 | Negligible | 321.00 | 1.00 |
| 87. | | | | Bhramini Dattani | - | | 1,500 | Negligible | 321.00 | 0.48 |
| 88. | December 17, 2024 | Geeta Dinesh Dattani | Promoter Group | Sunil Vashdev Gvalani | - | Sale of Equity Shares | 6,000 | 0.01 | 321.00 | 1.93 |
| 89. | | | | Niharika Jolly* | - | | 3,000 | Negligible | 321.00 | 0.96 |
| 90. | December 17, 2024 | Beena Paresh Dattani | Promoter Group | Ajay Jain | - | Sale of Equity Shares | 31,000 | 0.04 | 321.00 | 9.95 |
| 91. | | | | Hiranya Jaysinh Ashar | - | | 24,900 | 0.03 | 321.00 | |

| | | | |
|--------------------------------------|------------------------------------|---|-------|
| Dinesh Vrajdas Dattani | Promoter Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹371.88 million | Nil |
| Vajubhai Investments Private Limited | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Vallabhdas Dattani HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Sonali Ajaykumar Dattani | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 30.36 |
| Dattani Dineshkumar Vrajdas HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹2.50 million | 5.56 |
| Beena Paresb Dattani | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹35.00 million | Nil |
| Anilkumar Vrajdas Dattani HUF | Promoter Group Selling Shareholder | Up to [•] Equity Shares of face value of ₹10 each aggregating up to ₹17.50 million | Nil |

v. Pursuant to the Transfers, details of (i) the average cost of acquisition disclosed in the chapter 'Summary of the Offer Document - Average Cost of Acquisition of our Promoters and the Selling Shareholders' on page 31 of the RHP; and (ii) the weighted average cost of acquisition in the chapter 'Summary of the Offer Document - Weighted average cost of acquisition of all Equity Shares transacted in the 3 years, 18 months and 1 year preceding the date of this Red Herring Prospectus' on page 32 of the RHP shall be updated as follows:

Average Cost of Acquisition of our Promoters and the Selling Shareholders

The average cost of acquisition per Equity Share for our Promoters and Selling Shareholders is:

| Name | Number of Equity Shares acquired | Average Cost of Acquisition per Equity Share (in ₹)* |
|----------------------------|----------------------------------|--|
| Promoters | | |
| Ajay Vallabhdas Dattani# | 7,327,650 | 3.40 |
| Anilkumar Vrajdas Dattani# | 66,43,400 | Nil |
| Dinesh Vrajdas Dattani# | 68,71,700 | 3.51 |
| Paresb Vrajilal Dattani# | 7,012,600 | 3.51 |
| Nimbus Trust ^ | 10,475,000 | Nil |
| D&G Family Trust ^ | 10,475,000 | Nil |
| A&J Family Trust ^ | 10,475,000 | Nil |
| P&B Family Trust ^ | 10,475,000 | Nil |

#Also, the Selling Shareholders.

^ Equity Shares held jointly with certain Promoters and certain members of Promoter Group.

* As certified by Jain Tripathi & Co, Independent Chartered Accountant, pursuant to a certificate dated December 17, 2024.

| Name of Promoter Group Selling Shareholders | Number of Equity Shares Held | Average cost of acquisition per share (in ₹)* |
|---|------------------------------|---|
| Sonali Ajaykumar Dattani | 168,000 | 30.36 |
| Vajubhai Investments Private Limited | 18,000 | 5.56 |
| Vallabhdas Dattani HUF | 18,000 | 5.56 |
| Dattani Dineshkumar Vrajdas HUF | 18,000 | 5.56 |
| Beena Paresb Dattani | 1,28,400 | Nil |
| Anilkumar Vrajdas Dattani HUF | 69,900 | Nil |
| Paresb Kumar V Dattani HUF | 1,11,330 | Nil |
| Jayshree Anilkumar Dattani | 4,400 | Nil |
| Ajay Kumar V Dattani HUF | 600 | 1.67 |
| Vallabhdas Dattani | 1,33,450 | Negligible |

* As certified by Jain Tripathi & Co, Independent Chartered Accountant, pursuant to a certificate dated December 17, 2024.

Weighted average cost of acquisition of all Equity Shares transacted in the 3 years, 18 months and 1 year preceding the date of this Red Herring Prospectus

| Period | Weighted average cost of acquisition per Equity Share (in ₹) ^ | Cap Price is 'x' times the weighted average cost of acquisition ^ | Range of acquisition price per Equity Share: lowest price - highest price (in ₹) ^ |
|--|--|---|--|
| Last one year preceding the date of this Red Herring Prospectus | 321.00 | 1 | 321.00 |
| Last 18 months preceding the date of this Red Herring Prospectus | 321.00 | 1 | 321.00 |
| Last three years preceding the date of this Red Herring Prospectus | 321.00 | 1 | 321.00 |

*As certified by Jain Tripathi & Co, Independent Chartered Accountant, pursuant to a certificate dated December 17, 2024.

v. The details of in the chapter 'Basis for Offer Price - Weighted average cost of acquisition (WACA), Floor Price and Cap Price' as disclosed on page 164 of the RHP shall be updated in the Prospectus as follows to disclose the transactions set out below:

| Date of transaction | Number of Equity Shares allotted | Name of the Transferor | Name of the Transferee | Face value (₹) | Issue price per equity share (₹) | Nature of consideration | Total consideration |
|---------------------|----------------------------------|--------------------------|------------------------|----------------|----------------------------------|-------------------------|---------------------|
| December 17, 2024 | 67,000 | Vallabhdas Dattani | Hiranya Jaysinh Ashar | 10 | 321 | Cash | 2,15,07,000 |
| December 17, 2024 | 31,150 | Paresb Kumar Dattani HUF | Adip Vinodrai Poojara | 10 | 321 | Cash | 99,99,150 |
| December 17, 2024 | 31,000 | Beena Dattani | Ajay Jain | 10 | 321 | Cash | 99,51,000 |
| December 17, 2024 | 31,000 | Dineshkumar Dattani | Arjun Nishit Dhruva | 10 | 321 | Cash | 99,51,000 |
| December 17, 2024 | 31,000 | Anilkumar Dattani | Raj Kumar Jain | 10 | 321 | Cash | 99,51,000 |
| Total | 1,91,150 | | | | | | 6,13,59,150 |

Weighted average cost of acquisition (WACA) for Secondary Transactions (in ₹)

321

The above Notice should be read in conjunction with the RHP and accordingly references in the RHP stand updated pursuant to this Notice. The information in this Notice supplements the RHP and updates the information in the RHP as applicable. Investors should read this Notice in conjunction with the RHP before making any investment decisions in the Offer. This Notice does not reflect all the changes that have occurred between the date of filing of the RHP and the date hereof, and accordingly does not include all the changes and / or updates which shall be included in the Prospectus. Please note that the information included in the Red Herring Prospectus will be suitably updated, including to the extent stated in this Corrigendum, as may be applicable, in the Prospectus, as and when filed with the RoC, SEBI and the Stock Exchanges

All capitalized terms used in this Notice shall, unless the context otherwise requires, have the same meaning as ascribed in the RHP.

| BOOK RUNNING LEAD MANAGERS | REGISTRAR TO THE OFFER | COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER |
|---|--|---|
|  <p>DAM CAPITAL DAM Capital Advisors Limited One BKC, Tower C, 15th Floor, Unit No. 1511, Bandra Kurla Complex, Bandra (East), Mumbai - 400 051, Maharashtra, India Tel: +91 22 4202 2500; E-mail: Sanathan.ipo@damcapital.in Website: www.damcapital.in Investor Grievance E-mail: complaint@damcapital.in Contact person: Arpi Chheda SEBI registration number: MB/INM000011336</p> |  <p>ICICI Securities Limited ICICI Venture House, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400025, Maharashtra, India Tel: +91 22 6807 7100; E-mail: sanathan.ipo@icicisecurities.com Website: www.icicisecurities.com Investor Grievance E-mail: customercare@icicisecurities.com</p> |  <p>KFin Technologies Limited (formerly known as KFin Technologies Private Limited) Selenium, Tower B, Plot No. 31 and 32, Gachibowli, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500 032, Telangana, India Tel: +91 40 6716 2222; E-mail: stl.ipo@kfinetech.com Investor Grievance E-mail: einward.nis@kfinetech.com Website: www.kfinetech.com Contact person: M. Murali Krishna SEBI registration number: INR000000221</p> |

All capitalised terms used herein and not specifically defined shall have the same meaning as ascribed to them in the RHP.

Place: Dadra & Nagar Haveli, Silvassa
Date: December 17, 2024

For SANATHAN TEXTILES LIMITED
On behalf of the Board of Directors
Sd/-
Dsouza Jude Patrick
Company Secretary & Compliance Officer

SANATHAN TEXTILES LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offer of its Equity Shares and has filed a red herring prospectus dated December 13, 2024 with the RoC. The RHP is made available on the website of the SEBI at www.sebi.gov.in as well as on the website of the BRLMs i.e., DAM Capital Advisors Limited at www.damcapital.in and ICICI Securities Limited at www.icicisecurities.com, the website of the NSE at www.nseindia.com and the website of the BSE at www.bseindia.com and the website of the Company at https://www.sanathan.com. Any potential investor should note that investment in equity shares involves a high degree of risk and for details relating to such risks, please see the section "Risk Factors" beginning on page 34 of the RHP. Potential investors should not rely on the DRHP for making any investment decision but should only rely on the information included in the RHP filed by the Company with the RoC.

The Equity Shares offered in the Offer have not been, and will not be, registered under the U.S. Securities Act and may not be offered or sold within the United States, except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirements of the U.S. Securities Act and applicable state securities laws. Accordingly, the Equity Shares are only being offered and sold outside the United States in "offshore transactions" as defined in and in reliance on Regulation S under the U.S. Securities Act and the applicable laws of the jurisdictions where such offers and sales are made. There will be no public offering of securities in the United States.

વલસાડની નેશનલ લોક અદાલતમાં ૧૨૦૧૦ કેસોમાં રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫ નું સમાધાન કરાયું

માહિતી બ્યુરો: વલસાડ, વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૨૦૧૦ કેસોમાં રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫નું સમાધાન થયું હતું. આ અદાલતોમાં પેહિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે કિર્મીનાલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા



જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ- જાહેરાત-કરાર પાલન વિગેરે સંબંધિત દાવા વિગેરે મળી કુલ-૮૮૧ કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્યા હતા તથા સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજિસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ-૭૮૭૧ કેસો મુકવામાં આવ્યા હતા તેમજ બેન્ક-ફાયાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈન્ચલણ

વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ- ૧૪૮૫૪ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેહિંગ કેસો કુલ- ૩૪૩ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ- ૫૮૩૮ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૫૮૨૯ મળી કુલ-૧૨૦૧૦ કેસો નિકાલ કરવામાં આવ્યા હતા અને આ કેસોમાં કુલ રૂ. ૨૯,૬૬,૪૧,૪૬૫ નું સમાધાન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો તેમજ વકીલશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

કિશોરીને ૭ વર્ષ અગાઉ લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીની ધરપકડ

જનાદેશ પ્રતિનિધિ, ભરૂચ - ભરૂચના દહેજના રહિયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કિશોરીને ભગાડી જનાર કરાર આરોપીની કાર્યમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે. ભરૂચ કાર્યમ બ્રાન્ચ દ્વારા મહીલા અભ્યાસ સંબંધિત ગુનાઓમાં નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન દહેજના રહિયાદ ગામેથી સાત વર્ષ અગાઉ લગ્નની લાલચે કિશોરીને ભગાડી જનાર આરોપી હાલ વડોદરાના સાવલી નજીક રહેતો હોવાની પોલીસને ખાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડા પાડી સાવલી નજીક આવેલ ચર્ચમાંથી આરોપી કસના કટારાની અપહત કિશોરી સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ પરી છે.

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો

વલસાડ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરાવાઈ

જનાદેશ પ્રતિનિધિ, વલસાડ, વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા રવિ કૃષિ મહોત્સવ દરમિયાન વલસાડ તાલુકાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની માહિતી માટે મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરાયું હતું જે અંતર્ગત વલસાડ તાલુકાના ખેડૂતોને કોચવાડા ગામ ખાતે રાધિકા ઓર્ગેનિક્સમાં વેલ્યુ એડિશનની માહિતી આપવામાં આવી હતી. રાબડા ગામ ખાતે શૈલેશભાઈ પટેલના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી જેમાં અંદાજે ૧૫૦



જેટલા ખેડૂતોએ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન આત્મા વિભાગમાંથી વલસાડ તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર કેવલ બી પટેલ અને પ્રિતેશ જી. પટેલ હાજર રહી ખેડૂતોને માહિતી પૂરી પાડી હતી.

ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૨૪થી ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ સુધી કચ્છના અભ્યાસ પ્રવાસે

જનાદેશ પ્રતિનિધિ, કચ્છ : ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના સભ્યો આગામી તા. ૨૪ થી તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગ અંતર્ગત કચ્છ જિલ્લાનો અભ્યાસ પ્રવાસ કરશે. અંદાજ સમિતિના સભ્યોનો અભ્યાસ પ્રવાસ

તા. ૨૪ ડિસેમ્બર ૨૦૨૪ના દિવસે ગાંધીનગરથી શરૂ થશે. ત્યારબાદ ગાંધીનગરથી કચ્છના ધોળાવીરા વિશ્વ ધરોહર સ્થળ અને મ્યુઝીયમની મુલાકાત કરી કાળો ડુંગર-રોડ ટુ હેવન- જવા રવાના થશે, સાથોસાથ પ્રવાસના પ્રથમ દિવસે દતાત્રેય મંદિર, ધોરડો ખાતે ટેન્ટ સિટીમાં સાંસ્કૃતિક

કાર્યક્રમ નિહાળી રાત્રિ રોકાણ કરશે. અભ્યાસ પ્રવાસના બીજા દિવસે તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંદાજ સમિતિના સભ્યો સફેદ રણ જવા માટે રવાના થશે, ત્યાં જઈને સરનારાં નિહાળશે, ત્યારબાદ પ્રવાસીઓના આશ્રય સ્થાનની મુલાકાત લઈને માતાના મઠ જવા

રવાના થશે, તેમજ નારાયણ સરોવર અને કોટેશ્વરનો પ્રવાસ કરશે. જ્યારે અભ્યાસ પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે તા. ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંદાજ સમિતિના સભ્યો ભૂજ જવા રવાના થશે, ત્યાં તેઓ સુરલભીટ હેડ વર્ક્સ સાઈટની મુલાકાત અને સ્મૃતિવનની મુલાકાત લેશે, ત્યારબાદ તેઓ અંજાર ખાતે આવેલ જેસલ ? તોરલની સમાધિની મુલાકાત લેશે. તા. ૨૬ ડિસેમ્બરના દિવસે પ્રવાસ પૂર્ણ કરી ગાંધીનગર પરત રવાના થશે તેમ ગુજરાત વિધાનસભા સચિવાલય ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

દહેજમાં બંધ મકાનમાંથી ચોરી કરનાર તસ્કરની ધરપકડ, ચોરીના દાગીના ખરીદનાર સોની પણ ઝડપાયો



જનાદેશ પ્રતિનિધિ, ભરૂચ : ભરૂચ દહેજમાં બંધ મકાનમાં ચોરી કરવાના કારસામાં પોલીસે ચોરી કરનારા તસ્કર તેમજ તેમની પાસેથી સોનાના દાગીના ખરીદનાર બે સોનીને ઝડપી પાડ્યો છે. ભરૂચના દહેજના ટાવર ફળિયામાં રહેતાં અને મુળ દાહોદના બંગેલાં ગામના કરશન બારિયા દહેજના ટાવર ફળિયામાં રહેતાં અને મુળ દાહોદના બંગેલાં ગામના કરશન બારિયા પાસેથી ચોરીનો મુદ્દામાલ પડ્યું હતું કે, ચોરીના માટે પરિવાર સાથે વતન ગયાં હતાં. દરમિયાનમાં તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી ૮ હજાર રોકડા તેમજ ૭૩ હજારના ચાંદીના દાગીના મળી કુલ ૮૧ હજારની ચોરી કરી ગયાં હતાં. દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તસ્કરો અને પગેરૂં મેળવવા માટેની કવાવત હાથ ધરતાં ભાતમીદારો થકી માલુમ પડ્યું હતું કે, ચોરીના



કારસામાં દહેજમાં જ બોરડી ફળિયામાં રહેતો અનિલ રાઠોડે ચોરી કરી હતી. જેથી ટીમે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે આમોદના રાહુલ સંતોષ સોની તેમજ દહેજના રમેશચંદ્ર બાબુલાલ સોનીને દાગીના વેચ્યાં હોવાનું કબુલ કરતાં ટીમે તે બંનેની પણ ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

જેતપુરપાવીના કરાલી પોલીસ દ્વારા નાની અમરોલ ગામે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમનું આયોજન કરાયું

જનાદેશ પ્રતિનિધિ, છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કરાલી પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા અને લોકોની સુખાકારીમાં વધારો કરવા અને હાલ માં ચાલી રહેલા સાયબર કાર્યમ અટકાવવા નાની અમરોલ ગામે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો. કરાલી પોલીસ ના મહિલા સબ ઈન્સ્પેક્ટર ડી. કે. પંડ્યાની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ દ્વારા સાયબર કાર્યમ અટકાવવા માટે, આપણા ફોન કોલ પર આવેલ ઓટીપી કોઈ ને નહીં આપવા જણાવાયું હતું. તેમજ ૧૧૨ હેલ્પલાઇન, અને હાલ માં વધી રહેલા સાયબર ફોડ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી, એ ઉપરાંત વાહન અકસ્માતના ગુનાઓમાં મૃત્યુ નું -માણ વધી રહ્યું હોય, ત્યારે અકસ્માત ના કિસ્સા માં હેલ્પેટ પહેરવા થી મૃત્યુ થી બચી શકાય છે, તથા જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનો તરફ થી આધાર કાર્ડને લગતા -ગે કરવામાં આવ્યા હતા તેમાં પણ આધાર કાર્ડ સુધારા અંગેના -ગેનું નિરાકરણ લાવવા બાબતે વિસ્તૃત જાણકારી પી.એસ.આઈ પંડ્યા તરફ થી આપવામાં આવી હતી.

